



# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત) આયોજિત

## યોગાસન સ્પર્ધા ૨૦૨૫

### કેટેગરી

1. 09 થી 16 વર્ષ
2. 17 થી 35 વર્ષ
3. 36 થી વધુ.....
4. GSYB સાથે જોડાયેલ કોચ/ટ્રેનર

### રજિસ્ટ્રેશન

તા.01 થી 15 જાન્યુઆરી-2025

### ઓડિશન

તા.20 થી 25 જાન્યુઆરી-2025

- ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વર્ગમાં / ક્લાસમાં ઓડિશન આપવા માટે યોગ વર્ગ ના સમયે જવાનું રહેશે.

સ્પર્ધા જિલ્લા કક્ષા, ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાની રહેશે.

યોગાસન સ્પર્ધા સાથે ઇનામો જીતવાની અમુલ્ય તક

- યોગાસન સ્પર્ધા - ૨૦૨૫ માં જિલ્લા કક્ષાથી લાગ લેનાર તમામ સ્પર્ધક ને **ડિજિટલ સર્ટિફિકેટ** આપવામાં આવશે. વિજેતા ને ફિઝિકલ સર્ટિફિકેટ તેમજ વિજેતા રકમ આપવામાં આવશે.

યોગાસન સ્પર્ધા - ૨૦૨૫ માં લાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરો.

રજીસ્ટ્રેશન લીંક: [WWW.GSYB.IN](http://WWW.GSYB.IN)

રજીસ્ટ્રેશનની અંતિમ: તારીખ.15 જાન્યુઆરી 2025.



# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)

## યોગાસન સ્પર્ધા - ૨૦૨૫

- જિલ્લા કક્ષાથી રાજ્ય કક્ષા સુધીની રજીસ્ટ્રેશન થી સ્પર્ધાની તારીખ..

રજીસ્ટ્રેશન	તા.૦૧ થી ૧૫ જાન્યુઆરી-૨૦૨૫
ઓડીશન	તા.૨૦ થી ૨૫ જાન્યુઆરી-૨૦૨૫
જિલ્લા કક્ષા	તા.૦૯/૦૨/૨૦૨૫
ઝોન કક્ષા	તા.૧૬/૦૨/૨૦૨૫
રાજ્ય કક્ષા	તા.૨૮/૦૨/૨૦૨૫ સંભવિત

- કેટેગરી

ક્રમ	વયગ્રુપ
૧	૦૯ થી ૧૬
૨	૧૭ થી ૩૫
૩	૩૬ થી ૭૫૨
૪	GSYB સાથે જોડાયેલ કોચ/ટ્રેનર

નોંધ: ઉમર ની ગણતરી માટે કટ ઓફ ડેટ તા.૦૧/૦૧/૨૦૨૫ ધ્યાનમાં લેવાની રહેશે.

- પ્રાઈઝની રકમ

યોગાસન સ્પર્ધા	સંખ્યા	જિલ્લા કક્ષાએ વિજેતાની રકમ (દરેક વિજેતાને)	ઝોન કક્ષાએ વિજેતાની રકમ (દરેક વિજેતાને)	રાજ્ય કક્ષાએ વિજેતાની રકમ (દરેક વિજેતાને)
પ્રથમ વિજેતા	૪ ભાઈઓ + ૪ બહેનો	રૂ. ૩,૦૦૦	રૂ. ૬,૦૦૦	રૂ. ૨૧,૦૦૦
દ્વિતીય વિજેતા	૪ ભાઈઓ + ૪ બહેનો	રૂ. ૨,૦૦૦	રૂ. ૭,૦૦૦	રૂ. ૧૭,૫૦૦
તૃતીય વિજેતા	૪ ભાઈઓ + ૪ બહેનો	રૂ. ૧,૦૦૦	રૂ. ૫,૦૦૦	રૂ. ૧૫,૦૦૦

- યોગાસન સ્પર્ધા - ૨૦૨૫ માં જિલ્લા કક્ષાથી ભાગ લેનાર તમામ સ્પર્ધક ને **ડિજિટલ સર્ટિફિકેટ** આપવામાં આવશે. વિજેતા ને ફિઝિકલ સર્ટિફિકેટ તેમજ વિજેતા રકમ આપવામાં આવશે.



# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)

યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

## જિલ્લા કક્ષા/ઝોન કક્ષા/ રાજ્ય કક્ષા એ યોગાસન સ્પર્ધાના સ્પર્ધક માટેના સામાન્ય નિયમો

1. આ સ્પર્ધા વ્યક્તિગત પ્રસ્તુતિની રહેશે.
2. આ સ્પર્ધામાં **રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે**. જો સ્પર્ધકે રજીસ્ટ્રેશન કરાવેલ નહિ હોય તો સ્પર્ધક કોઈપણ સંજોગોમાં સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહિ.
3. આ યોગાસન સ્પર્ધાનો મુખ્ય હેતુ યોગનો પ્રચાર-પ્રસાર અને પ્રસિદ્ધિ માટે છે.
4. દરેક સ્પર્ધકે આધારકાર્ડ અને તેની એક નકલ સાથે રાખવી ફરજિયાત છે.
5. સ્પર્ધક તેની સાથે પાણીની બોટલ, યોગ મેટ, નેપકીન લાવવાનું રહેશે.
6. રજીસ્ટ્રેશન સમયે ફોર્મમાં દર્શાવેલ અને પસંદ કરેલ આસનો જ રજૂ કરવાના રહેશે. આસનની પ્રસ્તુતિ દરમિયાન કોઈપણ સાધનનો ઉપયોગ કરી શકાશે નહિ.
7. સ્પર્ધકનો સિરિયલ નંબર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આપવામાં આવશે અને એ ક્રમ મુજબ જ સ્પર્ધામાં સ્પર્ધકે પ્રસ્તુતિ માટે આવવાનું રહેશે.
8. સમગ્ર સ્પર્ધા 04 કેટેગરી માં યોજાશે:
  - 1. કેટેગરી:1 (9 વર્ષ થી 16 વર્ષ )
  - 2. કેટેગરી:2 (17 વર્ષ થી 35 વર્ષ)
  - 3. કેટેગરી:3 (36 વર્ષ કે તેથી વધુ ઉંમર માટે)
  - 4. કેટેગરી:4 પ્રોફેશનલ કેટેગરી (ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ ટ્રેનરો/યોગ કોચ)
9. કેટેગરી 1 થી 3 માટે ઉંમર માં કટ-ઓફ ડેટ 01.01.2025 પ્રમાણે રહેશે. કેટેગરી 4 માટે 15 વર્ષથી ઉપરના બધા જ..
10. કેટેગરી - 4 પ્રોફેશનલ કેટેગરી જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કોચ/ યોગટ્રેનરે સ્પર્ધાનું ફોર્મ ભરતા સમયે સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. જૂનું સર્ટિફિકેટ હશે તો પણ ભાગ લઈ શકશે.
11. એક સ્પર્ધક એક જ કેટેગરી માં ભાગ લઈ શકશે. જો એક થી વધુ કેટેગરી માં ભાગ લેશે તો તેને સ્પર્ધા માટે અયોગ્ય જાહેર કરવામાં આવશે.
12. જો કોઈપણ વયજુથમાં ત્રણ કે ત્રણ થી ઓછી સ્પર્ધક ની સંખ્યા હોય ત્યારે જો સ્પર્ધકની પ્રસ્તુતિ(પરફોર્મન્સ) યોગ્ય નહી હોય તો તેમને વિજેતામાં (પ્રથમ, દ્વિતીય કે તૃતીય) સ્થાન મળવા પાત્ર નથી.
13. કોઈપણ કક્ષાની સ્પર્ધામાં આવવા-જવા માટેનો પ્રવાસ ખર્ચ અને અન્ય કોઈપણ ભથ્થું મળવાપત્ર રહેશે નહિ.
14. જરૂર પડ્યે આપ દ્વારા રજૂ થયેલ માહિતી અંગે ના પુરાવા ચીફ જજ/ યોગ બોર્ડ ના અધિકારી સમક્ષ રજૂ કરવાના રહેશે.
15. સ્પર્ધા દરમિયાન કોઈ પણ ઇજા ના થાય તેનું ધ્યાન સ્વયં સ્પર્ધકે રાખવાનું છે, તેના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની કોઈ પણ જવાબદારી રહેશે નહિ.
16. સ્પર્ધકને જણાવવામાં આવેલ સમયે રિપોર્ટિંગ કરવાનું રહેશે. તેનું નામ ઘોષિત થાય અને 3 કોલ સુધી માં હાજર નહી થાય તો તેને ગેરહાજર જાહેર કરી દેવામાં આવશે. અને 3 કોલ બાદ આવશે તો પણ તેને સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે નહિ જેની ખાસ નોંધ લેશો.



# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)

યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

17. સ્પર્ધામાં દરેક વયજૂથ અને પ્રોફેશનલ કેટેગરીવાઇઝ જિલ્લામાંથી પુરુષ માંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય તેમ ત્રણ સ્પર્ધક વિજેતા ઘોષિત થશે અને તે જ પ્રમાણે કેટેગરીવાઇઝ મહિલામાંથી પણ પ્રથમ, દ્વિતીય અને તૃતીય તેમ ત્રણ સ્પર્ધક ની વિજેતા ઘોષિત કરવામાં આવશે. તે જ પ્રમાણે ઝોન કક્ષાની સ્પર્ધામાં નિયમ મુજબ ભાગ લઈ શકશે અને ઝોન કક્ષા માંથી કેટેગરીવાઇઝ ત્રણ પુરુષ પ્રથમ, દ્વિતીય અને તૃતીય અને મહિલામાંથી પણ કેટેગરીવાઇઝ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા થયેલા સ્પર્ધકો નિયમ મુજબ રાજ્ય કક્ષાની સ્પર્ધા માં ભાગ લઈ શકશે. તે પ્રમાણે રાજ્ય કક્ષાએ કેટેગરીવાઇઝ એમ કુલ પુરુષ માંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય અને તે જ પ્રમાણે મહિલામાંથી પણ કેટેગરીવાઇઝ પ્રથમ, દ્વિતીય અને તૃતીય તેમ કુલ 24 સ્પર્ધકો રાજ્ય કક્ષા એ વિજેતા થશે.
18. દરેક સ્પર્ધકે અપારદર્શક અને યોગાસન સ્પર્ધા ને અનુરૂપ જ કોશ્ચ્યુમ ધારણ કરવાનો રહેશે. કોશ્ચ્યુમ બંધ ગળાનું અને કોઈ પણ પ્રકાર ના કટ વિનાનું હોવું જોઈએ. આસનો ની ખરેખર સ્થિતિ જોઈ શકાય તે માટે સ્કીન ટાઈડ કોશ્ચ્યુમ જ પહેરવાનો રહેશે. (નાના વયજૂથ એટલે કે કેટેગરી:1 (9 થી 16 ) અને કેટેગરી:2 (17 થી 35 ) ભાઈઓ અને બહેનો એ હાફ કોશ્ચ્યુમ અને કેટેગરી:3 અને કેટેગરી:4 ના ભાઈઓ અને બહેનો ફૂલ કોશ્ચ્યુમ અથવા સ્કીન ટાઈડ ટી-શર્ટ અને યોગ આસન ને અનુરૂપ પેન્ટ માં જ પ્રસ્તુતિ કરવાની રહેશે અન્યથા કોશ્ચ્યુમ ના માર્ક કટ કરી લેવામાં આવશે.)
19. સ્પર્ધક હળવો મેક-અપ કરી શકશે પણ તેનાથી તેની ઓળખ છુપાવી જોઈએ નહિ.
20. આસનો ના પ્રસ્તુતિ સમયે કોઈપણ પ્રકાર નું મ્યુઝીક વગાડી શકાશે નહિ.
21. ઇલેક્ટ્રોનિક સાધનો કે કોઈ સંકેતની મદદથી સ્પર્ધક આસનો રજૂ કરશે તો તેને અયોગ્ય જાહેર કરી ડિસ્કવોલિફાઈ કરવામાં આવશે.
22. સ્ટેજ મેનેજર, જજ(ટેકનિકલ) પાસે સ્પર્ધકે પોતાનું નામ, ચેસ્ટ નં. અને આસનો ની કરેલ પસંદગી ચેક કરી લેવાની રહેશે. આ જવાબદારી સ્પર્ધકની રહેશે. સ્પર્ધા દરમિયાન કઈ જ જણાવવા માં નહી આવે.
23. દરેક સ્પર્ધકે ફક્ત સ્ટેજ પર આવતા અને પરત જતાં જ “નમસ્તે” અભિવાદન કરવાનું રહેશે. (ચાલુ સ્પર્ધાએ આસન પ્રસ્તુતિ વચ્ચે, આસને-આસને, નમસ્તે કરવું નહિ)
24. એક આસન પ્રસ્તુત કર્યા બાદ બીજા આસન માં જવા માટે જજ સૂચના આપે પછી જ આસન શરૂ કરવાનું રહેશે.
25. કોઈપણ આસનને બાંધવાનો/ રજૂ કરવાનો મહત્તમ સમય 60 સેકેન્ડ રહેશે.
26. આસનોના હોલ્ડિંગનો સમય આસનોના ચાર્ટ સાથે દર્શાવેલ છે તે મુજબ રહેશે. જે જિલ્લા કક્ષાના આસનોના ચાર્ટ સાથે દર્શાવેલ છે.
27. જિલ્લા કક્ષા અને ઝોન કક્ષાએ એક આસનના 10 માર્કસ રહેશે, તે પ્રમાણે 05 આસન ના 50 માર્કસ રહેશે તથા રાજ્ય કક્ષાએ એક આસનના 10 માર્કસ રહેશે, તે પ્રમાણે 08 આસન ના 80 માર્કસ રહેશે.
28. રજીસ્ટ્રેશન સમયે પસંદ કરેલ આસનો જો રજૂ ન કરી શકે તો તે આસન બદલી નહિ શકાય અને તે આસનના માર્ક 0 મળશે.
29. જિલ્લા કક્ષા અને ઝોન કક્ષાએ સ્પર્ધકને આસનોના 3 ગ્રુપ આપવામાં આવ્યા છે. જે પૈકી ગ્રુપ-એ માં 2 ફરજિયાત આસનો આપવામાં આવ્યા છે. ગ્રુપ-બી માં આપેલ આસનો પૈકી 2 આસનો સ્પર્ધક પોતાની પસંદ મુજબ ના આસનો કરશે. અને ગ્રુપ-સી માંથી એક આસન ડ્રો મુજબ નું આસન કરવાનું રહેશે. (2+2+1) આ રીતે કુલ 5 આસનો ની પ્રસ્તુતિ કરવાની રહેશે.



# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)

યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

30. રાજ્ય કક્ષાએ એક આસનના 10 માર્ક્સ રહેશે, તે પ્રમાણે 08 આસન ના 80 માર્ક્સ રહેશે અને સાથે-સાથે 1 આવૃત્તી સુર્યનમસ્કાર મંત્ર સાથે = 10 માર્ક્સ અને સ્પર્ધા સમયે ૦૨-વિશિષ્ટ આસન કરવાના રહેશે= 10 માર્ક્સ (ચાર્ટ સિવાયના અન્ય કોઈ હશે) તેમ 80+20 તો કુલ 100 માર્ક્સ રહેશે.
31. રાજ્ય કક્ષાએ સ્પર્ધકને આસનોના 3 ગ્રુપ આપવામાં આવ્યા છે. જે પૈકી ગ્રુપ-એ માં 3 ફરજિયાત આસનો આપવામાં આવ્યા છે. ગ્રુપ-બી માં આપેલ આસનો પૈકી 3 આસનો સ્પર્ધક પોતાની પસંદ મુજબ ના આસનો કરશે. અને ગ્રુપ-સી માંથી બે આસન ડ્રો કરી તે મુજબ નું આસન કરવાનું રહેશે. (3+3+2+1+1) આ રીતે કુલ 8 આસનો ની પ્રસ્તુતિ કરવાની રહેશે અને 1 આવૃત્તી સુર્યનમસ્કાર અને ૦૨- વિશિષ્ટ આસન કરવાના રહેશે.
32. સ્પર્ધામાં કોઈપણ બાબતને લઈને આખરી નિર્ણય ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર નો રહેશે.
33. અપીલ અધિકારી તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ખાસ ફરજ પર ના અધિકારી ને અપીલ કરી શકાશે. જે માટે અપીલ શુલ્ક રૂ.1000/- આપવાની રહેશે.

## • ઓડીશન અંગે ની સૂચનાઓ

1. સ્પર્ધકે રજીસ્ટ્રેશન કરાવ્યાનો આધાર તથા પોતાનું આધાર કાર્ડ સાથે લઈને આવવાનું રહેશે.
2. સ્પર્ધકે લિસ્ટમાં ના નજીક ના યોગ ક્લાસમાં જઈ ઓડીશન આપી શકશે.
3. સંબંધિત સાધક/ ટ્રેનર વર્ગના સંચાલક ઓડીશન લેશે.
4. ઓડીશન સમયે સુર્યનમસ્કાર, જિલ્લા કક્ષાના આસનો તથા ઓમકારનું નિદર્શન કરવાનું રહેશે.
5. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વર્ગમાં /ક્લાસમાં ઓડીશન આપવા માટે યોગ વર્ગ ના સમયે જવાનું રહેશે જે તા.20 થી 25 જાન્યુઆરી 2025 ના જવાનું રહેશે.
6. ઓડીશન જે સ્પર્ધક નું થઈ જાય તેઓ ની ઓનલાઈન એન્ટ્રી યોગ વર્ગ સંચાલક કોચ/ટ્રેનર દ્વારા કરવાની રહેશે.
7. સ્પર્ધાના નિયમો વાંચી લેવા અને જાણી લેવાના રહેશે.

॥ અથ યોગાનુશાસનમ્ ॥



# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)

યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

## જિલ્લા કક્ષાએ યોગાસન સ્પર્ધા

1. કેટેગરી:1 (9 વર્ષ થી 16 વર્ષ )
2. કેટેગરી:2 (17 વર્ષ થી 35 વર્ષ)
3. કેટેગરી:3 (36 વર્ષ કે તેથી વધુ ઉંમર માટે)
4. કેટેગરી:4 પ્રોફેશનલ કેટેગરી (ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ ટ્રેનરો/યોગ કોચ)

॥ અથ યોગાનુશાસનમ્ ॥



# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)


યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

કેટેગરી: ૯ થી ૧૬ વર્ષ (બહેનો-ભાઈઓ)


## જીલ્લા કક્ષા:

- સ્પર્ધકે કુલ 5 આસનો ની પ્રસ્તુતિ કરવાની રહેશે.
- ગ્રુપ-એ માંથી ચાર્ટ માં આપેલ બંને આસન ફરજિયાત છે અને તેનો હોલ્ડિંગ સમય 30 સેકન્ડ રહેશે.
- ગ્રુપ-બી માંથી ચાર્ટમાં આપેલ ત્રણ આસનો પૈકી સ્પર્ધકે તેની પસંદના કોઈપણ બે આસનો ની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય 10 સેકન્ડ રહેશે.
- ગ્રુપ-સી માંથી ચાર્ટમાં આપેલ ત્રણ આસનો પૈકી ડ્રૉ માં આવે તે એક આસનની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય 10 સેકન્ડ રહેશે.


ક્રમ	ગ્રુપ-એ	ગ્રુપ -બી	ગ્રુપ -સી
૧	તિતિભાસન	પાદંગુષ્ઠ ધનુરાસન	કોનાર્કાસન
૨	પરિવૃત્ત પાર્શ્વ કોણાસન	વૃશ્ચિકાસન-1	પરિવૃત્ત એકપાદ શિરાસન
૩		સુપ્ત-ત્રિવિક્રમાસન	તાંડવાસન



Tittibhasana




PADANGUSHTHA-DHANURASANA




Konarkasana



PARIVRITTA PARSHVA KONASANA




VRUSHCHIKASANA - I



Parivritta-Eka-Pada-Shirasana



1. SUPTA-TRIVIKRAMASANA



Tandavasana



# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)

યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

કેટેગરી: 17 થી 35 વર્ષ (બહેનો-ભાઈઓ)

## જીલ્લા કક્ષા:

- સ્પર્ધકે કુલ 5 આસનો ની પ્રસ્તુતિ કરવાની રહેશે.
- ગ્રુપ-એ માંથી ચાર્ટ માં આપેલ આપેલ બંને આસન જ ફરજિયાત છે અને તેનો હોલ્ડિંગ સમય 30 સેકન્ડ રહેશે.
- ગ્રુપ-બી માંથી ચાર્ટમાં આપેલ ત્રણ આસનો પૈકી સ્પર્ધકે તેની પસંદના કોઈપણ બે આસનો ની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય 10 સેકન્ડ રહેશે.
- ગ્રુપ-સી માંથી ચાર્ટમાં આપેલ ત્રણ આસનો પૈકી ડ્રૉ માં આવે તે એક આસનની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય 10 સેકન્ડ રહેશે.


ક્રમ	ગ્રુપ-એ	ગ્રુપ -બી	ગ્રુપ -સી
૧	ક્રોન્યાસન	દંડાયમાન જાનુશિરાસન	એકપાદ વિપરિતા શલભાસન
૨	શિરશાસન	એકાપાદ લંબકોણ ચક્રસન	મરોડાસન-૧
૩		ફેનીન્દ્રાસન	વામનાસન




Krounchasana




DANDAYAMANA JANUSHIRASANA




Ekapada-Viparit-Shalbasana




5.SHIRSHASANA




Eka-Pada-Lambakona-Chakrasana



Maroodasana-1



Fanindrasana



Vamanasana





# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)




યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

## કેટેગરી: ૩૬ વર્ષ કે તેનાથી વધુ (બહેનો-ભાઈઓ)

### જીલ્લા કક્ષા:

- સ્પર્ધકે કુલ ૫ આસનો ની પ્રસ્તુતિ કરવાની રહેશે.
- ગ્રુપ-એ માંથી ચાર્ટ માં આપેલ આપેલ બંને આસન ફરજિયાત છે અને તેનો હોલ્ડિંગ સમય ૩૦ સેકન્ડ રહેશે.
- ગ્રુપ-બી માંથી ચાર્ટમાં આપેલ ત્રણ આસનો પૈકી સ્પર્ધકે તેની પસંદના કોઈપણ બે આસનો ની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય ૧૦ સેકન્ડ રહેશે.
- ગ્રુપ-સી માંથી ચાર્ટમાં આપેલ ત્રણ આસનો પૈકી ડ્રૉ માં આવે તે એક આસનની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય ૧૦ સેકન્ડ રહેશે.

ક્રમ	ગ્રુપ-એ	ગ્રુપ -બી	ગ્રુપ -સી
૧	રણવીરાસન	વિરભદ્રાસન-૩	એકપાદ રાજકપોતાસન
૨	ઉષ્ટ્રાસન	વીરનીલાસન	અર્ધ મત્સ્યેન્દ્રાસન
૩		પરિવૃત ત્રિકોણાસન	પ્રસારિત પાદોત્તાનાસન





# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)


યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

**કેટેગરી: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાયેલ કોચ/ટ્રેનર (બહેનો-ભાઈઓ)**


● **જીલ્લા કક્ષા:**

- સ્પર્ધકે કુલ 5 આસનો ની પ્રસ્તુતિ કરવાની રહેશે.
- ગ્રુપ-એ માંથી ચાર્ટ માં આપેલઆપેલ બંને આસન ફરજિયાત છે અને તેનો હોલ્ડિંગ સમય 30 સેકન્ડ રહેશે.
- ગ્રુપ-બી માંથી ચાર્ટમાં આપેલ ત્રણ આસનો પૈકી સ્પર્ધકે તેની પસંદના કોઈપણ બે આસનો ની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય 10 સેકન્ડ રહેશે.
- ગ્રુપ-સી માંથી ચાર્ટમાં આપેલ ત્રણ આસનો પૈકી ડ્રૉ માં આવે તે એક આસનની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય 10 સેકન્ડ રહેશે.

ક્રમ	ગ્રુપ-એ	ગ્રુપ -બી	ગ્રુપ -સી
૧	કુર્માસન	વિરભદ્રાસન-૩	પરિવૃત્ત પાર્શ્વકોણાસન
૨	અર્ધ ધનુરાસન	વિપરીત નૌકાસન	વૃક્ષાસન
૩		પશ્ચિમોત્તાનાસન	અર્ધ મત્સ્યેન્દ્રાસન







1.KURMASANA



Veeerbhadrasana-III



Baddha-Parivritta-Parshva-Konasana



Paschimottanasana





# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)

યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

## ઝોન કક્ષાએ યોગાસન સ્પર્ધા

1. કેટેગરી:1 (9 વર્ષ થી 16 વર્ષ )
2. કેટેગરી:2 (17 વર્ષ થી 35 વર્ષ)
3. કેટેગરી:3 (36 વર્ષ કે તેથી વધુ ઉંમર માટે)
4. કેટેગરી:4 પ્રોફેશનલ કેટેગરી (ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ ટ્રેનરો/યોગ કોચ)

॥ અથ યોગાનુશાસનમ્ ॥



# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)




યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

કેટેગરી: ૯ થી ૧૬ વર્ષ (બહેનો-ભાઈઓ)

## • ઝોન કક્ષા:

- સ્પર્ધકે કુલ 5 આસનો ની પ્રસ્તુતિ કરવાની રહેશે.
- ગ્રુપ-એ માંથી ચાર્ટ માં આપેલ આપેલ બંને આસન ફરજિયાત છે અને તેનો હોલ્ડિંગ સમય 45 સેકન્ડ રહેશે.
- ગ્રુપ-બી માંથી ચાર્ટમાં આપેલ ત્રણ આસનો પૈકી સ્પર્ધકે તેની પસંદના કોઈપણ બે આસનો ની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય 15 સેકન્ડ રહેશે.
- ગ્રુપ-સી માંથી ચાર્ટમાં આપેલ ત્રણ આસનો પૈકી ડ્રૉ માં આવે તે એક આસનની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય 10 સેકન્ડ રહેશે.

ક્રમ	ગ્રુપ-એ	ગ્રુપ -બી	ગ્રુપ -સી
૧	કુક્કુટાસન	એકપાદ વિપરીત દંડાસન	પ્રજાકટાસન
૨	પૂર્ણ-ચક્રાસન	વૃશ્ચિકાસન-2	ઉત્તિથપાદ પરિવૃત જાનુ શિરાસન
૩		ઉર્ધ્વ પ્રસારીત એકપાદાસન	સારસાસન





# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)







યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

કેટેગરી: 17 થી 35 વર્ષ (બહેનો-ભાઈઓ)

## ઝોન કક્ષા:

- સ્પર્ધકે કુલ 5 આસનો ની પ્રસ્તુતિ કરવાની રહેશે.
- ગ્રુપ-એ માંથી ચાર્ટ માં આપેલ આપેલ બંને આસન ફરજિયાત છે અને તેનો હોલ્ડિંગ સમય 45 સેકન્ડ રહેશે.
- ગ્રુપ-બી માંથી ચાર્ટમાં આપેલ ત્રણ આસનો પૈકી સ્પર્ધકે તેની પસંદના કોઈપણ બે આસનો ની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય 15 સેકન્ડ રહેશે.
- ગ્રુપ-સી માંથી ચાર્ટમાં આપેલ ત્રણ આસનો પૈકી ડ્રૉ માં આવે તે એક આસનની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય 10 સેકન્ડ રહેશે.

ક્રમ	ગ્રુપ-એ	ગ્રુપ -બી	ગ્રુપ -સી
૧	પરિવૃત્ત પશ્ચિમોત્તનાસન	ઉર્ધ્વમુખ તિતિભાસન	વિભક્ત વિપરીત શલભાસન
૨	સુગ્રીવાસન	એકાપાદ ઉર્ધ્વદંડ ધનુરાસન	પરિવૃત્ત વિશ્વામિત્રાસન
૩		મલયાસન	સારસાસન





# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)





યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

કેટેગરી: ૩૬ વર્ષ કે તેનાથી વધુ (બહેનો-ભાઈઓ)

## ઝોન કક્ષા:

- સ્પર્ધકે કુલ ૫ આસનો ની પ્રસ્તુતિ કરવાની રહેશે.
- ગ્રુપ-એ માંથી ચાર્ટ માં આપેલ આપેલ બંને આસન ફરજિયાત છે અને તેનો હોલ્ડિંગ સમય ૪૫ સેકન્ડ રહેશે.
- ગ્રુપ-બી માંથી ચાર્ટમાં આપેલ ત્રણ આસનો પૈકી સ્પર્ધકે તેની પસંદના કોઈપણ બે આસનો ની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય ૧૫ સેકન્ડ રહેશે.
- ગ્રુપ-સી માંથી ચાર્ટમાં આપેલ ત્રણ આસનો પૈકી ડ્રૉ માં આવે તે એક આસનની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય ૧૦ સેકન્ડ રહેશે.

ક્રમ	ગ્રુપ-એ	ગ્રુપ -બી	ગ્રુપ -સી
૧	પાદહસ્તાસન	બકાસન	પરિવૃત્ત પશ્ચિમોત્તાનાસન
૨	પરિવૃત્ત પાર્શ્વકોણાસન	મત્સ્યાસન	ચકાસન
૩		અર્ધ નટરાજાસન	પાદાંગુસ્તાસન





# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)



યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

**કેટેગરી: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાયેલ કોચ/ટ્રેનર (બહેનો-ભાઈઓ)**

• **ઝોન કક્ષા:**

1. સ્પર્ધકે કુલ 5 આસનો ની પ્રસ્તુતિ કરવાની રહેશે.
2. ગ્રુપ-એ માંથી ચાર્ટ માં આપેલ આપેલ બંને આસન ફરજિયાત છે અને તેનો હોલ્ડિંગ સમય 45 સેકન્ડ રહેશે.
3. ગ્રુપ-બી માંથી ચાર્ટમાં આપેલ ત્રણ આસનો પૈકી સ્પર્ધકે તેની પસંદના કોઈપણ બે આસનો ની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય 15 સેકન્ડ રહેશે.
4. ગ્રુપ-સી માંથી ચાર્ટમાં આપેલ ત્રણ આસનો પૈકી ડ્રૉ માં આવે તે એક આસનની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય 10 સેકન્ડ રહેશે.

ક્રમ	ગ્રુપ-એ	ગ્રુપ -બી	ગ્રુપ -સી
૧	હલાસન	બકાસન	પરિવર્ત પશ્ચિમોત્તનાસન
૨	અર્ધ સલભાસન	મત્સ્યાસન	ચકાસન
૩		અર્ધ નટરાજાસન	પાદાંગુસ્તાસન





# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)

યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

## રાજ્ય કક્ષાએ યોગાસન સ્પર્ધા

- કેટેગરી:1 (9 વર્ષ થી 16 વર્ષ )
- કેટેગરી:2 (17 વર્ષ થી 35 વર્ષ)
- કેટેગરી:3 (36 વર્ષ કે તેથી વધુ ઉંમર માટે)
- કેટેગરી:4 પ્રોફેશનલ કેટેગરી (ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ ટ્રેનરો/યોગ કોચ)

॥ અથ યોગાનુશાસનમ્ ॥





# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)










યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

કેટેગરી: ૯ થી ૧૬ વર્ષ (બહેનો-ભાઈઓ)

## રાજ્ય કક્ષા:

- સ્પર્ધકે કુલ 8 આસનો ની પ્રસ્તુતિ કરવાની રહેશે.
- ગ્રુપ-એ માંથી ચાર્ટ માં આપેલ ત્રણ આસન ફરજિયાત છે અને તેનો હોલ્ડિંગ સમય 60 સેકન્ડ રહેશે.
- ગ્રુપ-બી માંથી ચાર્ટમાં આપેલ ચાર આસનો પૈકી સ્પર્ધકે તેની પસંદના કોઈપણ ત્રણ આસનો ની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય 15 સેકન્ડ રહેશે.
- ગ્રુપ-સી માંથી ચાર્ટમાં આપેલ ચાર આસનો પૈકી ડ્રૉ માં આવે તે બે આસનની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય 10 સેકન્ડ રહેશે.
- સાથે-સાથે 1 આવૃત્તી સુર્યનમસ્કાર મંત્ર સાથે = 10 માર્કસ અને સ્પર્ધા સમયે ૦૨-વિશિષ્ટ આસન કરવાના રહેશે= 10 માર્કસ (ચાર્ટ સિવાયના અન્ય કોઈ હશે) તેમ 80+20 તો કુલ 100 માર્ક રહેશે.

ક્રમ	ગ્રુપ-એ	ગ્રુપ -બી	ગ્રુપ -સી
૧	પરિપૂર્ણ મત્સ્યેન્દ્રાસન	પરશુપાશાસન	મૃગા મુખાસન
૨	ઉત્તિથ એકપાદ સ્કંધાસન	વિભક્ત વિપરીત શલભાસન	વામદેવ ત્રિપુરાસન
૩	ઉર્ધ્વમુખ વીરભદ્રાસન	દ્વિપાદ કોકીલાસન	મુક્તહસ્ત ત્રિવિક્રમાસન
૪		પરિવૃત ઉપાવિસ્ત કોણાસન	ઉર્ધ્વમુખ હસ્તપદ્માસન





# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)


યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

કેટેગરી: 17 થી 35 વર્ષ (બહેનો-ભાઈઓ)


## રાજ્ય કક્ષા:

- સ્પર્ધકે કુલ 8 આસનો ની પ્રસ્તુતિ કરવાની રહેશે.
- ગ્રુપ-એ માંથી ચાર્ટ માં આપેલ ત્રણ આસન ફરજિયાત છે અને તેનો હોલ્ડિંગ સમય 60 સેકન્ડ રહેશે.
- ગ્રુપ-બી માંથી ચાર્ટમાં આપેલ ચાર આસનો પૈકી સ્પર્ધકે તેની પસંદના કોઈપણ ત્રણ આસનો ની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય 15 સેકન્ડ રહેશે.
- ગ્રુપ-સી માંથી ચાર્ટમાં આપેલ ચાર આસનો પૈકી ડ્રૉ માં આવે તે બે આસનની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય 10 સેકન્ડ રહેશે.
- સાથે-સાથે 1 આવૃત્તી સુર્યનમસ્કાર મંત્ર સાથે = 10 માર્કસ અને સ્પર્ધા સમયે ૦૨-વિશિષ્ટ આસન કરવાના રહેશે= 10 માર્કસ (ચાર્ટ સિવાયના અન્ય કોઈ હશે) તેમ 80+20 તો કુલ 100 માર્ક રહેશે.

ક્રમ	ગ્રુપ-એ	ગ્રુપ -બી	ગ્રુપ -સી
૧	પશ્ચાસન	યોગ-નિદ્રાસન	મહાનિલાસન
૨	પરિપૂર્ણ મત્સ્યેન્દ્રાસન	પદંકા-વૃષિકાસન-II	બ્રહ્મસ્ત્રાસન
૩	કમ્બલાસન	એકપાદ વક્ષ મયૂરાસન	દ્વિપાદ- કોકિલાસન
૪		ઉર્ધ્વમુખ વીરભદ્રાસન	પરિવૃત્ત સ્વર્ગા દ્વિજાસન




Pashstrasana




Paripurna-Matsyendrasana




Kambalāsana




Yoga-Nidrasana




Padanka-Vrishikasana - II




Ekapada-Vaksha-Mayoorasana




Urdhvamukha-Veerabhadrasana




Mahaneelasana



Bramhastrasana



Dwipad-Kokilasana



Parivrutta-Swarga-Dwijāsana



# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)









યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

## કેટેગરી: ૩૬ વર્ષ કે તેનાથી વધુ (બહેનો-ભાઈઓ)

### રાજ્ય કક્ષા:

- સ્પર્ધકે કુલ ૮ આસનો ની પ્રસ્તુતિ કરવાની રહેશે.
- ગ્રુપ-એ માંથી ચાર્ટ માં આપેલ ત્રણ આસન ફરજિયાત છે અને તેનો હોલ્ડિંગ સમય ૬૦ સેકન્ડ રહેશે.
- ગ્રુપ-બી માંથી ચાર્ટમાં આપેલ ચાર આસનો પૈકી સ્પર્ધકે તેની પસંદના કોઈપણ ત્રણ આસનો ની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય ૧૫ સેકન્ડ રહેશે.
- ગ્રુપ-સી માંથી ચાર્ટમાં આપેલ ચાર આસનો પૈકી ડ્રૉ માં આવે તે બે આસનની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય ૧૦ સેકન્ડ રહેશે.
- સાથે-સાથે ૧ આવૃત્તી સુર્યનમસ્કાર મંત્ર સાથે = ૧૦ માર્કસ અને સ્પર્ધા સમયે ૦૨-વિશિષ્ટ આસન કરવાના રહેશે = ૧૦ માર્કસ (ચાર્ટ સિવાયના અન્ય કોઈ હશે) તેમ ૮૦+૨૦ તો કુલ ૧૦૦ માર્ક રહેશે.

ક્રમ	ગ્રુપ-એ	ગ્રુપ -બી	ગ્રુપ -સી
૧	ઉગ્રાસન	પુષ્પકાસન	પૂર્ણ ધનુરાસન
૨	હલાસન	બદ્ધ પદ્માસન	અર્ધ બદ્ધપદ્મ પશ્ચિમોત્તાસન
૩	પરિવિરિત-જાનુ-શીર્ષાસન	મહાવીરાસન	મરીચયાસન-૩
૪		પાદહસ્તોત્તાસન	શીર્ષાસન





# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)











યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

## કેટેગરી: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાયેલ કોચ/ટ્રેનર (બહેનો-ભાઈઓ)

### રાજ્ય કક્ષા:

- સ્પર્ધકે કુલ 8 આસનો ની પ્રસ્તુતિ કરવાની રહેશે.
- ગ્રુપ-એ માંથી ચાર્ટ માં આપેલ ત્રણ આસન ફરજિયાત છે અને તેનો હોલ્ડિંગ સમય 60 સેકન્ડ રહેશે.
- ગ્રુપ-બી માંથી ચાર્ટમાં આપેલ ચાર આસનો પૈકી સ્પર્ધકે તેની પસંદના કોઈપણ ત્રણ આસનો ની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય 15 સેકન્ડ રહેશે.
- ગ્રુપ-સી માંથી ચાર્ટમાં આપેલ ચાર આસનો પૈકી ડ્રૉ માં આવે તે બે આસનોની પ્રસ્તુતિ કરવાની છે અને તેનો હોલ્ડિંગ સમય 10 સેકન્ડ રહેશે.
- સાથે-સાથે 1 આવૃત્તી સુર્યનમસ્કાર મંત્ર સાથે = 10 માર્કસ અને સ્પર્ધા સમયે ૦૨-વિશિષ્ટ આસન કરવાના રહેશે= 10 માર્કસ (ચાર્ટ સિવાયના અન્ય કોઈ હશે) તેમ 80+20 તો કુલ 100 માર્ક રહેશે.

ક્રમ	ગ્રુપ-એ	ગ્રુપ -બી	ગ્રુપ -સી
૧	સાલમ્બ-સર્વગાસન-1	દંડાયમાન-જાનુશિરાસન	પૂર્ણ ધનુરાસન
૨	ગરુડાસન	બદ્ધ પદ્માસન	ઉર્ધ્વમુખ-પશ્ચિમોત્તાનાસન-1
૩	પરિવિરિત-જાનુ-શીર્ષાસન	પાદહસ્તોત્તાનાસન	મરીચ્યાસન-૩
૪		મહાવીરાસન	કુક્કુટાસન





# ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત)

યોગાસન સ્પર્ધા  
૨૦૨૫

